

અરજી નંબર :—

**દિરાખ મેળવવા માટેનું અરજી પત્રક
ફક્ત વાહનનોની યોજના માટે**

વિના મૂલ્યે



ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન

બ્લોક નં. ૧૦, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

યોજનાનું નામ :— પેસેન્જર ઓટોરીક્ષા

તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (અરજદારે ફોટો ઉપર સહી કરવી.)
--

આધાર નંબર :—

(૧) અરજદારની વિગત :—

- (૧) પુરેપુરુ નામ :—
- (૨) સરનામું :—
- (૩) જન્મ તારીખ :— ઉંમર (જાહેરાતની તારીખ)
- (૪) કુટુંબના સત્યોની સંખ્યા :— તે પૈકી કમાતા સત્યોની સંખ્યા :—
- (૫) કુટુંબના સત્યોની વાર્ષિક આવક રૂ.
(અ) ઉદ્યોગ ધ્વામાંથી :— રૂ. (બ) જમીન ખેતીમાંથી :— રૂ.
(ક) નોકરીમાંથી :— રૂ. (૩) દૃષ્ટક મજૂરી/ અન્ય વિ. :— રૂ.
કુલ આવક :— રૂ.
- (૬) અરજદારની જાતિ તથા પેટા જાતિ (સક્ષમ અધિકારીશ્રીના દાખલાની પ્રમાણિત નકલ સામેલ કરવી)
- (૭) શૈક્ષણિક લાયકાત :—
- (૮) બી.પી.એલ. યાદી નં. :—
- (૯) વિકલાંગ હોય તો તેની વિગત
- (૧૦) અરજદારે કે તેઓના કુટુંબના અન્ય સત્યએ અગાઉ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની યોજનાઓ કે અન્ય સરકારી એજન્સી મારફત લોન / સહાય મેળવેલ છે કે કેમ ? તેની વિગતો આપવી.
.....
- (૧૧) અ. વાહન ચલાવવાનો અનુભવ છે કે કેમ ? હા / ના. હા, તો કેટલા સમયનો
બ. વાહન ચલાવવા માટે લાયસન્સ તથા ઓથોરાઇઝેશન/બેઝી વિગત.
અ. લાયસન્સ નંબર :— રીત્યુ કરવાની તારીખ :—
બ. ઓથોરાઇઝેશન/બેઝ નંબર :—
- (૧૨) સ્થાવર મિલકત ધરાવો છો કે કેમ ? હા / ના. હા તો અંદાજીત રકમ રૂ.
- (૧૩) ટેલીફોન નંબર (એસ.ટી.ડી. કોડ સાથે) મોબાઈલ નંબર :—
- (૧૪) બેન્ક ખાતાની વિગત :—
(અ) બેન્કનું નામ :— (બ) શાખાનું નામ :—
(ક) ખાતાનો નંબર :— (૩) ખાતાનો પ્રકાર :— બચત ખાતું/ ચાલુ ખાતું
(દ) બેંકનો માઈક્રો કોડ :— (એફ) બેંકનો આઈ.એફ.એસ. કોડ

સાક્ષીની સહી :—

નામ :—

સરનામું :—

અરજદારની સહી :—

નામ :—

સરનામું :—

બાંહેધરી પત્રક

૧. આથી હું પ્રમાણિત કરું છું કે, અરજીના નમૂનામાં જે કોઈ વિગતો દાખલા આપેલ છે, તે મારી જાણ પ્રમાણે તદ્વન સાચી છે. તેમાં પાછળથી કોઈપણ વિગત સાચી ન હોવાનું સાબિત થાય તો મળેલ લોનની રકમ એક સાથે ભરપાઈ કરવા બંધાઉ છું અને તે બદલ ખાત્રી આપું છું.
૨. લોન લેવા માટે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર તરફથી જે કંઈ શરતો બોલીઓ નક્કી થશે તે પ્રમાણે વર્તવા આથી હું બાંહેધરી આપું છું.
૩. આ અગાઉ મેં કે મારા કુટુંબની અન્ય કોઈ વ્યક્તિને નિગમ/ કોઈપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેન્ક પાસેથી વાહન ખરીદવા અથવા અન્ય ધંધા માટે કોઈપણ પ્રકારનું વિરાણ મેળવેલ નથી કે માંગણી કરેલ નથી તે બદલ ખાત્રી આપું છું. જેમાં કંઈ પણ કસૂર થશે તો નિગમ કાયદેસર કાર્યવાહી કરવા કુલ મુખ્યત્વાર છે. વિરાણ મળેથી નિયમિત હપ્તા ભરવા, તે દરમ્યાન નિગમને મારું વાહન / સાધનો હાઈપોથીકેશનમાં રાખવા અને નાણાં સમયસર ન ભરવા માટે રૈવન્યુ રાહે વસુલાત લેવા અને દંડનીય વ્યાજ સાથે ભરપાઈ કરવા બંધાઉ છું તે માટે હું તેમજ મારા વંશ વારસો જવાબદાર રહેશે તે હું પ્રતિક્ષાપૂર્વક જાહેર કરું છું.
૪. અરજી પત્રકમાં ભરેલ તમામ વિગતો સાચી છે. પસંદગી થયા બાદ કોઈપણ તખક્કે મેં અરજી પત્રકમાં આપેલ વિગતો ખોટી જણાશે તો હું વિરાણ મેળવવા હક્કાર રહીશ નહીં જેની હું બાંહેધરી આપું છું.

અરજદારની સહી :—

નામ :—

સરનામું :—

ધિરાણ મેળવવા અંગે સુચનાઓ અને શરતો

૧. આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિની અને ગુજરાત રાજ્યના વતની હોય તે લોકોને જ આપવામાં આવશે.
૨. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૧ વર્ષથી નીચે અને ૫૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
૩. અરજદાર પાસે વાહન ચલાવવા માટેનું લાયસન્સ અને ઓથોરાઇઝેશન જાહેરાત મુજબ હોવું જરૂરી છે.
૪. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. ૮૮,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં.
૫. વ્હીકલ / સાધનો આગ, અક્સમાત, ચોરી, હુલ્લડ અને કુદરતી આફિતો / આતંક વિગેરે સામે રક્ષણ મળે તે માટે નિગમ તરફથી પ્રથમ વર્ષનો ફુલ વિમો લેવામાં આવશે. દર વર્ષે લાભાર્થીએ પ્રિમિયમ ભરી વિમો રીન્યુ કરવાનો રહેશે અને વિમા પોલીસી નિગમના નામે એસાઈન કરાવવાની રહેશે.
૬. વ્હીકલ / સાધનોનું નિગમની તરફેણમાં હાઈપોથીકેશન કરી આપવાનું રહેશે તથા નિગમ તરફથી નક્કી કરેલ બાહેંઘરી / જામીનખત વગેરે ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
૭. લોન પરત ભરપાઈ કરવા માટે અંગત જામીનગીરી ખત આપવાના રહેશે. તથા યોજનાના નિયમો મુજબ માગણી થયેથી વસુલાત પેટે ચેક આપવાના રહેશે.
૮. જ્યાં સુધી લોનની રકમ વ્યાજ સહિત પુરેપુરી ભરપાઈ ન થાય ત્યાં સુધી અરજદાર વ્હીકલ / સાધનો અન્ય વ્યક્તિને વેચી શકશે નહીં કે ગીરો મૂકી શકશે નહીં કે અન્યને તબદીલ કરી શકશે નહીં.
૯. નિગમ તરફથી વિરાણ કરવામાં આવેલ રકમ ઉપર નિયત દરે વ્યાજ લેવામાં આવશે. તથા નિગમ નક્કી કરે તે પ્રમાણે લોન હપ્તા દર માસે નિયમિત જમા કરાવવાના રહેશે. જો સમયસર હપ્તા નહીં ભરવામાં આવે તો નિગમ નક્કી કરે તે મુજબ દંડનીય વ્યાજ લેવામાં આવશે.
૧૦. ડયુ થયેલ હપ્તા ભરવામાં નહીં આવે તો ડિફોલ્ટ પાસેથી નિગમ તરફથી વધારાનો જે વ્યાજનો દર નક્કી થાય તે પ્રમાણે દંડનીય વ્યાજ લેવામાં આવશે.
૧૧. ચડત થયેલ સંણંગ ત્રણ હપ્તાઓ ભરવામાં નહીં આવે તો નિગમ તરફથી વાહન / સાધનો પરત લઈ, તેની હરાજી કરી બાકીની રકમ અરસપરસ ધોરણે વસુલ લેવા નિગમ હક્કદાર રહેશે.
૧૨. કોઈપણ એજન્સી / નિગમ / સંસ્થા પાસેથી અગાઉ લોન / સહાય લીધેલ હોય તો તેની વિગત આપવી. જો તેમાં ચૂક થશે તો અપાયેલ તમામ રકમ વ્યાજ સહિત એક સાથે વસુલ લેવામાં આવશે તથા અપાયેલ વાહન / સાધનો જપ્ત કરવામાં આવશે.
૧૩. કોઈપણ કારણસર લોન અરજી ફોર્મ બર્યા બાદ નિર્ણય કરવા માટે કે નિર્ણય થયા બાદ લાભાર્થીને ફાળવવાના વાહન / સાધનો આપવામાં વિલંબ થશે તો તે માટે કોર્પોરેશન જવાબદાર રહેશે નહીં.
૧૪. આવેલ અરજીઓની સંખ્યા તથા તેની ગુણવત્તાને ધ્યાન પણ નહીં અરજી મંજૂર કે નામંજૂર કરવાની સત્તા કોર્પોરેશનની રહેશે. આ અંગે કોઈપણ જાતની તકરાર કે કોઈ વિવાદ ચાલશે નહીં તથા કોઈ પત્ર વ્યવહાર કરવો નહીં.
૧૫. જામીનદારની માલિકીની ખેતીની જમીનના ડિસ્સામાં જમીન બોજા મુક્ત હોવી જોઈએ અને ધિરાણ મેળવે નિગમની તરફેણમાં જમીન ગીરોખત કરી આપવાની રહેશે.
૧૬. અરજીમાં દશવિલ તમામ વિગતોના આધારો પસંદગી થયા બાદ રજુ કરવાના રહેશે. જો આધારો રજુ કરવામાં નહીં આવે તો પસંદગી રદ થશે અને ધિરાણ મેળવવા હક્કદાર રહેશે નહીં.
૧૭. નિગમ તરફથી અન્ય વિગતો બોલીઓ અને શરતો વખતો વખતો વખત નક્કી થશે તે કબૂલ મંજૂર રાખવાની રહેશે.

ઉપરના તમામ નિયમો / શરતો મેં ધ્યાન પૂર્વક વાંચ્યા છે અને તે વાંચી સમજીને તે મને તેમજ મારા વંશ વારસોને કબૂલ મંજૂર છે. તેવી કબૂલાત આપું છું.

સાક્ષીની સહી :—.....

અરજદારની સહી :—.....

નામ :—.....

નામ :—.....

સરનામું :—

તારીખ :—

**અરજી ચકાસણી અંગેની વિગત
(ફક્ત કચેરીના ઉપયોગ માટે)**

૧. લોન અરજી ફોર્મ સાથે રજુ થયેલ સાધનિક કાગળો અંગે સ્થળ ચકાસણી કર્યા બાદ નીચે મુજબનો અભિપ્રાય આપવો.

ક્રમ	વિગત	હા / ના
૧.	અરજદાર દર્શાવેલ સરનામે રહે છે ?	
૨.	અરજદારે અરજીમાં જાણાવેલ વિગતો બરાબર છે ?	
૩.	અરજી ફોર્મ સાથે સામેલ દસ્તાવેજની ચકાસણી અસલ પ્રમાણપત્ર સાથે કરેલ છે તે બરાબર છે ?	
૪.	અરજદારે જાતિનો દાખલો તથા કુટુંબની વાર્ષિક આવકનો દાખલો સક્ષમ અધિકારીશ્રીનો જોડેલ છે ?	
૫.	વાહન ચલાવવા માટે આર.ટી.ઓ. તરફથી મળેલ લાયસન્સ અને ઓથોરાઈઝનની નકલ વાહન ચલાવવાને અનુરૂપ છે કે કેમ ?	
૬.	લાયસન્સ કરી તારીખ સુધીનું કાયદેસરનું છે ?	
૭.	જે વાહન માટે અરજી કરેલ છે, તે વાહનનો ધંધો આર્થિક રીતે પોખણક્ષમ છે કે કેમ ?	
૮.	અન્ય કોઈ વિગત હોય તો (જો હા હોય તો)	
૯.	લોન અરજી મંજુર કરવા માટેનો સ્પષ્ટ અભિપ્રાય	

સ્થળ :— ચકાસણી કરનારની સહી :—

તારીખ :— નામ :—

હોદ્દો :—

(૨) અરજી ફોર્મના સાધનિક કાગળો તથા જીલ્લા કચેરીના રેકર્ડ મુજબ ચકાસણી બાદ અરજદારને ઘિરાણ કરવા બાબતે જીલ્લા મેનેજરશ્રીનો જીલ્લા કક્ષાની કમિટીમાં ભલામણ કરવા બાબતે અભિપ્રાય

સ્થળ :— જીલ્લા મેનેજરની સહી :—

તારીખ :— નામ :—

(૩) જીલ્લા કક્ષાની પસંદગી સમિતિનો અરજી ભલામણ કરવા બાબતે અભિપ્રાય

સ્થળ :— જીલ્લા મેનેજરની સહી :—

તારીખ :— નામ :—

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન

ગાંધીનગર

જાહેરાત અનુભેની યોજનાઓ થ્રી વ્હીલર(ઓટોરીક્ષા/લોડીંગ રીક્ષા), પશુપાલન અને
નાનાપાયાની યોજનામાં વિવિધ ધંધાઓમાં
મહત્તમ લોનની રકમની વિગત દર્શાવતુ પત્રક.

(જે તે યોજનામાં અથવા ધંધામાં મહત્તમ લોનની રકમ કરતા વધુ ખર્ચ થાય તો તે વધારાની રકમ
લાભાર્થીએ ભોગવવાની રહેશે અને તે અંગેનું સંમતિપત્ર આપવાનું રહેશે.)

ક્રમ	ધંધા / વ્યવસાય / યોજનાનું નામ	મહત્તમ લોનની રકમ રૂ.		
		કુલ ધિરાણ	લાભાર્થી ફળો	નિગમની લોન
૧	થ્રી વ્હીલરની યોજના (ઓટોરીક્ષા / લોડીંગ રીક્ષા)	રૂ. ૧,૫૦,૦૦૦/-	રૂ. ૧૫,૦૦૦/-	રૂ. ૧૩૫,૦૦૦/-
૨	પશુપાલન	રૂ. ૧,૫૦,૦૦૦/-	રૂ. ૧૫,૦૦૦/-	રૂ. ૧૩૫,૦૦૦/-
૩	નાના પાયાની યોજના			
૧	કરીયાણાની દુકાન / પ્રોવિઝન સ્ટોર્સ	રૂ. ૭૫,૦૦૦/-	રૂ. ૭,૫૦૦/-	રૂ. ૬૭,૫૦૦/-
૨	રેડીમેડ કપડા/ગારમેન્ટ સ્ટોર્સ.	રૂ. ૭૫,૦૦૦/-	રૂ. ૭,૫૦૦/-	રૂ. ૬૭,૫૦૦/-
૩	મંડપ ડેકોરેશન	રૂ. ૧,૫૦,૦૦૦/-	રૂ. ૧૫,૦૦૦/-	રૂ. ૧૩૫,૦૦૦/-
૪	ઓટો રીપેરીંગ અને સાયકલ રીપેરીંગ	રૂ. ૧,૦૦,૦૦૦/-	રૂ. ૧૦,૦૦૦/-	રૂ. ૯૦,૦૦૦/-
૫	ટાયરપંચર	રૂ. ૫૦,૦૦૦/-	રૂ. ૫,૦૦૦/-	રૂ. ૪૫,૦૦૦/-
૬	સેન્ટીંગ કામ	રૂ. ૧,૫૦,૦૦૦/-	રૂ. ૧૫,૦૦૦/-	રૂ. ૧૩૫,૦૦૦/-
૭	ટાઇલ્સ પોલીસીંગ	રૂ. ૫૦,૦૦૦/-	રૂ. ૫,૦૦૦/-	રૂ. ૪૫,૦૦૦/-
૮	ફેટોગ્રાફી અને વિડીયોગ્રાફી	રૂ. ૧,૫૦,૦૦૦/-	રૂ. ૧૫,૦૦૦/-	રૂ. ૧૩૫,૦૦૦/-
૯	મોબાઇલ રીપેરીંગ	રૂ. ૫૦,૦૦૦/-	રૂ. ૫,૦૦૦/-	રૂ. ૪૫,૦૦૦/-
૧૦	ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનું રીપેરીંગ	રૂ. ૫૦,૦૦૦/-	રૂ. ૫,૦૦૦/-	રૂ. ૪૫,૦૦૦/-
૧૧	હીરા ઉદ્યોગ (ડાયમંડ કટાંગ એન્ડ પોલીસીંગ)	રૂ. ૧,૫૦,૦૦૦/-	રૂ. ૧૫,૦૦૦/-	રૂ. ૧૩૫,૦૦૦/-
૧૨	ક્રોમ્યુટર જોબવર્ક	રૂ. ૫૦,૦૦૦/-	રૂ. ૫,૦૦૦/-	રૂ. ૪૫,૦૦૦/-
૧૩	પશુ આહારનું વેચાણ	રૂ. ૧,૦૦,૦૦૦/-	રૂ. ૧૦,૦૦૦/-	રૂ. ૯૦,૦૦૦/-
૧૪	ક્રોસેટીકસની દુકાન	રૂ. ૭૫,૦૦૦/-	રૂ. ૭,૫૦૦/-	રૂ. ૬૭,૫૦૦/-
૧૫	દરજી કામ /એમ્બ્રોડરી/ભરતકામ	રૂ. ૫૦,૦૦૦/-	રૂ. ૫,૦૦૦/-	રૂ. ૪૫,૦૦૦/-
૧૬	ફેટો ફેમ અને પ્લાસ્ટિક લેમીનેશન	રૂ. ૫૦,૦૦૦/-	રૂ. ૫,૦૦૦/-	રૂ. ૪૫,૦૦૦/-
૧૭	આઇસ્ક્રીમ પાર્ટર અને ઠંડાપીણા	રૂ. ૧,૦૦,૦૦૦/-	રૂ. ૧૦,૦૦૦/-	રૂ. ૯૦,૦૦૦/-

૧૮	કટલરી સ્ટોર	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૧૯	ફળ-ફળાઈ અને શાકભાજુની દુકાન	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૨૦	મીઠાઇ ફરસાણની દુકાન	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૧	બ્યુટી પાર્લર	રૂ.૭૫,૦૦૦/-	રૂ.૭,૫૦૦/-	રૂ.૬૭,૫૦૦/-
૨૨	પોલ્ટ્રી ફાર્મ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૩	કેટરર્સ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૪	ગીફ્ટ આર્ટિકલ સ્ટોર્સ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૫	સુથારી કામ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૬	ચાર્મોધોગ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૨૭	વણાટકામ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૮	ફેબ્રીકેશન/વેલ્ડીંગ કામ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૨૯	પ્લાબર્ચિંગ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૦	પ્લાસ્ટીકના સાધનો વેચવાની દુકાન	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૩૧	મોચીકામ/બુટ-ચંપલની દુકાન	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૨	બેકરી	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૩૩	વાયરમેન	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૪	સાઉન્ડ સીસ્ટમ (ડી.જી.)	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૩૫	અગારબતી બનાવવી	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૬	મીણબતી બનાવવી	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૩૭	સીમેન્ટની આઇટમ બનાવવી	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૩૮	મીનરલ વોટર પ્લાન્ટ	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૩૯	લાઇટિંગ ડેકોરેશન	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૪૦	સાયબર કાફે	રૂ.૧,૫૦,૦૦૦/-	રૂ.૧૫,૦૦૦/-	રૂ.૧,૩૫,૦૦૦/-
૪૧	સ્કુલ અને લગેજ બેગ બનાવી અને રીપેરીંગ કામ	રૂ.૧,૦૦,૦૦૦/-	રૂ.૧૦,૦૦૦/-	રૂ.૯૦,૦૦૦/-
૪૨	ટી સ્ટોલ	રૂ.૫૦,૦૦૦/-	રૂ.૫,૦૦૦/-	રૂ.૪૫,૦૦૦/-
૪૩	અન્ય ધંધાઓ લાભાર્થી પસંદ કરે તે	નિગમ નક્કી કરે તે રકમ		